

February 14, 2022

To,
The Secretary,
Market Operations Department,
The BSE Ltd.
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
MUMBAI – 400 023.

Scrip Code: 500003

Capital Market Operations
The National Stock Exchange of India Ltd.
Exchange Plaza, 5th Fl., Plot No.C/1,
G Block, Bandra-Kurla Complex,
Bandra (E),
MUMBAI – 400 051.

Scrip Code: AEGISCHEM

Dear Sir/Madam,

Sub: Communication to Shareholders - Intimation on Tax Deduction on Dividend

Further to our letter dated February 11, 2022 on the aforesaid subject, we are enclosing herewith copies of newspaper advertisement published in newspapers viz., Financial Express (All India edition) and Daman Ganga Times (Vapi edition) on "General Communication to Shareholders on Tax Deduction at Source on Dividend", for the benefit of members and as a good corporate governance practise.

The above communication is also available on the website of the Company at www.aegisindia.com.

This is for your information.

Thanking you,

Yours faithfully, For AEGIS LOGISTICS LIMITED

MONICA GANDHI COMPANY SECRETARY

Encl.: as above

(Rs. in 000)

46,034.58

0.48

0.48

WWW.FINACIALEXPRESS.COM

10 FINANCIAL EXPRESS



राष्ट्रीय इस्पात निगम लिमिटेड RASHTRIYA ISPAT NIGAM LIMITED (A Government of India Enterprise) VISAKHAPATNAM STEEL PLANT

MATERIALS MANAGEMENT DEPARTMENT Ph:+91 891 2519503/3500234 Ext.21015.

email:dvravikumar@vizagsteel.com/ketha_mm@vizagsteel.com/ kmurali@vizagsteel.com GLOBAL TENDER NOTICE NO.Pur.22.17.004/0002 DT:08.02.2022

Global Tender Notice for Supply of 'IMPORTED COKING & PCI COAL' Work: Sealed tenders are invited for supply of 300,000 (Three Lakh) MT of 'Imported Coking Coals' and 50,000 (Fifty Thousand) MT of Imported 'PCI Coal', with a Shipping Tolerance of +/-10% as per the specifications indicated in Tender document. Last date & time for receipt of Tenders: 23.02.2022 by 10.30hrs(IST)

Tenderers who are interested to participate in the tender can download the tender document from the website WWW.VIZAGSTEEL.COM (under MM->MM Tenders) and submit their offer before 10.30 hrs IST on 23.02.2022 as per the instructions given in the Tender document. In case of difficulty in downloading of Tender document, the Tender document shall be sent by Post free of cost on written request from the Tenderer. CHIEF GENERAL MANAGER (MM)

For more details & corrigendum please visit regularly www.vizagsteel.com HAR EK KAAM DESH KE NAAM

AEGIS LOGISTICS LIMITED Regd. Office: 502 Skylon, 61.D.C., Char Rasta, Vapi 396 195, Dist. Valsad, Gujarat Corp. Office: 1202, Tower B, Peninsula Business Park, G. K. Marg, Lower Parel (W), Mumbai - 400013 Tel.: +91 22 6666 3666 Fax: +91 22 6666 3777 E-mail: aegis@aegisindia.com Website: www.aegisindia.com AEGIS

The Board of Directors of the Company, at its meeting held on February 10, 2022, declared an Interim Dividend of Rs. 2 (Rupees Two only) per equity share for the financial year 2021-22 and February 18, 2022, is fixed as a Record date to determine the names of shareholders who will be entitled to receive interim dividend. Pursuant to the provisions of the Incometax Act, 1961 ('the Act'), as amended by the Finance Act, 2020, dividend shall be taxable in the hands of the Shareholders w.e.f. April 01, 2020. The Company is therefore required to deduct tax at source on dividend to be paid. Determination of the TDS amount to be deducted by the Company will depend on the ascertainment of residential/legal status and submission of requisite documents by the Shareholders. Details in this regard, including requisite documents to be submitted for exemption from TDS for various categories of Shareholders, which have been emailed to the shareholders on February 11, 2022 are also available on the website of the Company at http://www.aegisindia.com/ Dividend.aspx Shareholders are requested to upload the documents with the Registrar and Transfer Agent ('RTA') of the Company viz. Link Intime India Pvt. Ltd. at https://linkintime.co.in/ formsreg/submission-of-form-15g-15h.html or email to aegisdivtax@linkintime.co.in with Subject "Tax Exemption related documents", latest by February 21, 2022. No communication on tax determination shall be entertained after the said date.

Consolidated

GENERAL COMMUNICATION TO SHAREHOLDERS ON TAX DEDUCTION AT SOURCE ON DIVIDEND

For Aegis Logistics Ltd.

Monica Gandhi **Company Secretary**

FORTIS HEALTHCARE LIMITED (CIN: L85110PB1996PLC045933)

Regd. Office: Fortis Hospital, Sector 62, Phase - VIII, Mohali-160062 Tel: +91 172 5096001; Fax No: +91 172 5096221 Website: www.fortishealthcare.com; Email: secretarial@fortishealthcare.com

STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

(₹ in Lakhs except EPS)

Place : Mumbai

Date: 11.02.2022

	Consolidated				
let Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) let Profit / (Loss) for the period before tax (after exceptional and/or Extraordinary items) let Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) otal Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other comprehensive Income (after tax)] equity Share Capital (Face Value of Rs. 10/- per share) deserves (excluding Revaluation Reserve) as shown in the server in the period (as the server).	Quarter Ended December 31, 2021	Nine Months Ended December 31, 2021	Quarter Ended December 31, 2020		
Total Income from Operations	1,47,334	4,36,086	1,18,720		
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	18,453	54,651	10,313		
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	19,292	86,134	10,313		
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	14,171	70,292	5,388		
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	14,974	70,693	5,999		
Equity Share Capital (Face Value of Rs. 10/- per share)	75,496	75,496	75,496		
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year (as at March 31, 2021)			22		
Earnings Per Share (of Rs 10/- each) (for continuing and discontinued operations)					
(a) Basic	1.55	6.45	0.40		
(b) Diluted	1.55	6.45	0.40		

		Standalone					
Particulars	Quarter Ended December 31, 2021	Nine Months Ended December 31, 2021	Quarter Ended December 31, 2020				
Turnover	22,796	65,235	18,436				
Profit / (loss) Before Tax	1,358	1,753	3,241				
Profit / (Loss) After Tax	855	1,099	2,125				

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchanges viz. www.nseindia.com and www.bseindia.com and that of the company at www.fortishealthcare.com. Fortis Healthcare Limited

For and on Behalf of Board of Directors

Dr. Ashutosh Raghuvanshi Managing Director & CEO DIN No. 02775637

Schneider Belectric

Schneider Electric Infrastructure Limited Registered Office: Milestone 87, Vadodara Halol Highway, Village Kotambi.

Post office Jarod, Vadodara - 391510, Gujarat, India Corporate Office: 9th Floor, DLF Building No. 10, Tower C, DLF Cyber City, Phase II,

Place: Gurugram

Date: February 11, 2022

Gurugram -122002, Haryana, India Tel: +91 124 3940400; Fax: +91 124 4222036; website: https://infra.schneider-electric.co.in

Statement of Unaudited Financial Results for the Quarter and nine months ended December 31, 2021 (Rupees Million except earning per share data)

				AND THE RESERVE OF THE PERSON		A STATE OF THE PARTY OF THE PARTY.	
		Quarter ended			Nine months ended		
Particulars	December 31, 2021 (Unaudited)	September 30, 2021 (Unaudited)	December 31, 2020 (Unaudited)	December 31, 2021 (Unaudited)	December 31, 2020 (Unaudited)	March 31, 2021 (Audited)	
Total income from operations	6,004.60	3,016.74	4,723.05	11,903.17	10,499.52	12,971.28	
Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	523.77	(87.43)	333.38	275.52	225.58	120.01	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items) (refer note 4)	523.77	(87.43)	333.38	275.52	102.41	(10.11)	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	523.77	(87.43)	333.38	275.52	102.41	(10.11)	
Total Comprehensive Income for the period	511.91	(89.83)	312.13	269.14	94.04	21.39	
Paid-up equity share capital (face value of Rs. 2/- each.)	478.21	478.21	478.21	478.21	478.21	478.21	
Other equity				-	## F	(442.75)	
Earnings per equity share (EPS) (not annualised)						- (c - 70	
a) Basic	2.19	(0.37)	1.39	1.15	0.43	(0.04)	
b) Diluted	2.19	(0.37)	1.39	1.15	0.43	(0.04)	

Notes:

Place : Mumbai

Date: February 10, 2022

- The above Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on February 10, 2022.
- 2. These financial results of the Company have been prepared in accordance with the Indian Accounting Standards (IND AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standard) rules, 2015 and relevant
- The Chief Operating Decision Maker "CODM" reviews the operations of the Company as a whole, i.e. single primary business segment viz. product and systems for electricity distribution, hence, there are no reportable segments as per Ind AS 108 "Operating Segments".
- 4. In the comparable periods, exceptional items represent expenses incurred towards organizational restructuring for improving efficiency in line with change in product lines and related employees settlement cost.
- The world is now experiencing another outbreak on account of new coronavirus variant and as a precautionary measure, India has started to reimpose regional restrictions. The impact of Covid-19, as well as restrictions on business and individual activities, has led to volatility and uncertainty in global and Indian markets and decrease economics activities. The Company has made an assessment of the impact of the continuing Covid-19 pandemic and basis the current guarter results and best estimates of revenue, expenses and current assets, as on the date of reporting, the Company does not anticipate any material impact on the recoverability of the carrying value of its assets. The management has also estimated future cash flows for the Company and believes that there is no impact on its ability to continue as going concern and meeting its liabilities as and when they fall due. However, considering the unpredictability of the pandemic and inherent uncertainty on the potential future impact of the Covid-19 pandemic, the Company's financial statements may differ from that estimated as on the date of approval of these financial results.
- As at the end of current quarter, the Company has total accumulated losses aggregating to MINR 3,296.57. The management has evaluated availability of sufficient funding to meet Company's obligations. For such evaluation, the management has considered various factors which include estimated future cash flows, availability of working capital facilities sanctioned by the banks and borrowings sourced from group companies. Basis such evaluation, the management is confident that the Company will be able to realise its assets and discharge its liabilities in the normal course of business. Therefore, these financial results have been prepared based on going concern assumption.
- 7. The Indian Parliament has approved the Code of Social Security, 2020, which would impact the contributions by the Company towards Provident Fund and Gratuity. The effective date from which the changes are applicable is yet to be notified and the final rules are yet to be framed. The Company will carry out an evaluation of the impact and record the same in financial results in the period in which the Code becomes effective and the related rules are published.
- Previous period figures have been reclassified/regrouped wherever necessary, to correspond with those of the current period 9. The full format of the Unaudited Financial Results are available on the websites of Stock Exchanges at www.bseindia.com and
- www.nseindia.com and can be accessed on Company's website at www.schneider-infra.in By Order of the Board,

For Schneider Electric Infrastructure Limited Sanjay Sudhakaran

Managing Director and Chief Executive Officer

NORTH EASTERN EXPORTERS LIMITED Regd. Office: 5B/1, 5th Floor, Saraswati Building, BSM Enclave, Tulsidham Complex

Jessore Road, Bangur, Kolkata- 700055 Corporate Office: Workez, RK Swamy Centre Door No. 3, Hansa Building Block-B, 147, Pathari Road, Thousand Lights, Chennai- 600006 TN Email Id: northeasternexporters@gmail.com Phone No: 022-49729990/1/2

CIN: L51909WB1983PLC035967 NOTICE FOR LOST OF CERTIFICATE OF REGISTRATION OF M/S. NORTH EASTERN EXPORTERS LIMITED

A NOTICE to the General Public and a submission to the governing authorities/ intermediaries under the applicable provisions is given that, the Certificate of Registration bearing no. 05.01304 issued by Reserve Bank of India dated 27th day of March, 1998 recognizing North Eastern Exporters Limited as a Non-Banking Financial Company has been lost/ misplaced while dispatching it to the Corporate office of the Company. The Public in general is being made aware and

is requested to inform the Company if the said original certificate is found and is invited to return the said Certificate to Mr. AlokTekriwal at the Regd office: 5B/1, 5th Floor, Saraswati Building, BSM Enclave, Tulsidham Complex, Jessore Road, Bangur, Kolkata- 700055 within 21 days from the receipt of this notice. The Company shall reserve the right to initiate

any legal action against anyone in an event of misuse of the said certificate and the person finding the same shall be held liable to send the said certificate to the above-mentioned address

AlokTekriwal Date: 11.02.2022 **Managing Director** Place : Kolkata DIN: 01375698

"IMPORTANT

advertising copy, it is not possible to verify its contants. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals adversing in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

CREMICA AGRO FOODS LIMITED

Regd. Office: 455, Sohan Palace, 2nd Floor, The Mall, Ludhiana, Punjab-141001, CIN: L15146PB1989PLC009676 Email: manager.cafl@gmail.com, Website: www.cafl.co.in, Contact No. 01826 222826

Extract of Un-audited Financial Results for the Quarter & Nine Months ended on 31st December, 2021

Sr Particulars Year to date ended Year ended Quarter ended 31,12,2021 30.09.2021 31.12.2020 31.12.2021 31.12.2020 31.03.2021 (Un-Audited) Un-Audited) (Un-Audited) (Un-Audited) (Un-Audited) (Audited) Total Income from Operations 942.60 893.28 405.12 2,673.70 1,654.43 2,292.34 430.36 1,179.12 508.28 Net Profit/(Loss) for the period 299.33 16.73 294.06 (before Tax, Exceptional and/or Extraordinary items) 508.28 Net Profit/(Loss) for the period 299.33 430.36 16.73 1,179.12 294.06 before tax (after Exceptional and/ or Extraordinary items) Net Profit/(Loss) for the period after 376.50 230.98 322.05 12.22 885.49 220.05 tax (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for 230.98 322.05 12.22 885.49 2,010.19 2,164.40 the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Paid-up Equity Share Capital 4495.50 4495.50 4495.50 4,495.50 4495.50 4495.50

Basic:

Diluted:

The Company is having only one business activity so the segment reporting under Ind AS-108 is not required.

0.05

0.05

2. The Above result were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting

0.07

0.07

0.00

0.00

0.20

0.20

- held on 10th February, 2022. The Statutory Auditor of the Company have provided Limited Review Report for the same.
- Figures of previous periods were re-grouped/re-classified wherever necessary to confirm to the periods of current periods.
- Indian Accounting Standards are applicable on the Company w.e.f 1st April 2019.

On behalf of Board For CREMICA AGRO FOODS LIMITED

0.45

0.45

SURENDAR KUMAR SOOD (Director) DIN: 01091404

Date: 10th February, 2022

Place: Ludhiana

(Face value of Rs.10/- each)

Reserves (excluding Revaluation

Reserve) as shown in the Audited

Balance Sheet at 31st March 2021

Earnings Per Share (of Rs. 10/-

each) (for continuing and

discontinued operations):



L65999KA2004PLC035329 Registered Office: Grape Garden, No. 27, 3rd A Cross, 18th Main, 6th Block, Koramangala.

Bengaluru 560095 Phone: #91 80 4071 2121 Email: investor.relations@ujjivanfin.com Statement of Consolidated Financial Results for the Quarter

and Nine Months ended December 31, 2021 (₹ in Lakhs) Quarter ended Nine Months ended

SI. No.	Particulars	Dec 31, 2021	Dec 31, 2020	Dec 31, 2021	Dec 31, 2020
140.			77 W		
1.	Total Income from Operations (Net)	70,808.73	77,174.16	2,14,469.99	2,34,932.66
2.	Net Profit / (Loss) (before tax, exceptional and / Extraordinary items)	(24,299.29)	(66,262.22)	(46,676.15)	(43,320.80)
3.	Net Profit / (Loss) before tax (after Exceptional and/or Extraordinary items)	(24,299.29)	(66,262.22)	(46,676.15)	(43,320.80)
4.	Net Profit / (Loss) after tax (after Exceptional and/or Extraordinary items)	(18,156.48)	(49,072.87)	(34,908.12)	(32,308.50)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(18,723.66)	(49,194.52)	(34,804.77)	(32,361.02)
6.	Paid up Equity Share capital	12,167.81	12,165.20	12,167.81	12,165.20
7.	Earnings per Share (EPS) Basic (₹): Diluted (₹):	(12.43) (12.43)	(33.61) (33.61)	2000 CO. CO. CO.	(22.10) (22.10)

Key numbers of standalone results are as under:

		Quarte	Quarter ended		Nine Months ended		
SI. No.	Particulars	Dec 31, 2021	Dec 31, 2020	Dec 31, 2021	Dec 31, 2020		
140.			udited				
1.	Total Income from Operations (Net)	170.53	184.05	506.34	674.31		
2.	Profit Before Tax	54,88	66,42	182.84	306.23		
3.	Profit After Tax	36.09	49.88	125.45	231.81		

1. The above results were reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their meeting held on February 11, 2022. The above is an extract of the detailed format of quarterly / annual financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter ended December 31, 2021 is available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com and also on the company's website www.uiiivan.com. 3. These financial results have been prepared in accordance with the recognition and

measurement principles of Indian Accounting Standard ("Ind AS") prescribed under Section 133 of the Companies Act, 2013 read with Companies (Indian Accounting Standards) Rules, By order of the Board

For Ujjivan Financial Services Limited Samit Ghosh Non-Executive Chairman DIN- 00185369

Place: Bengaluru Date: February 11, 2022 www.ujjivan.com



MOIL LIMITED

Telefax: 0712-2590644 | Telephone: 0712 - 2806154

Extracts of unaudited financial results for the quarter & nine months ended 31" December, 2021

Nine months **Particulars** Quarter ended 31-12-2021 31-12-2020 31-12-202 Unaudited Unaudited Unauditer Total income from operations 36335.93 26770.44 96841.47 Net profit /(loss) for the period (before tax, 16401.71 6998.16 32343.75 exceptional and /or extraordinary items) 3 Net profit /(loss) for the period before tax 16401.71 6998.16 32343.75 (after exceptional and /or extraordinary items) 4 Net profit/(loss) for the period after tax 12388.33 5138.40 24591.45 (after exceptional and /or extraordinary items) 5 Total comprehensive income for the period 11998.57 5328.10 23420.14 [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)] 6 Equity share capital (Face value of ₹10 each) 23732.79 23732.79 23732.79 Earnings per share from continuing operations (Face value of ₹10 each) 10.36 5.22 2.17 5.22 2.17 10.36

The above results, reviewed by the Audit Committee, have been approved by the Board of

- Directors in its meeting held on 11° February, 2022 and have been reviewed by statutory auditors of the company. This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable. 2) The above is an extract of the detailed format of financial results for the guarter and nine. months ended 31" December, 2021 filed with the Stock Exchanges under Regulation 33
- of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. Financial results in detailed format are available on the websites of Stock Exchanges (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (www.moil.nic.in). 8) The Board has approved an interim dividend of ₹ 3 per equity share for financial year
- 2021-22.
- 4) Previous period's figures have been regrouped/reclassified, wherever necessary to make them comparable. The figures for the quarter ended 31" December, 2021/2020 are balancing figures between the unaudited figures of nine months and reviewed figures upto 30° September, 2021/2020. For MOIL Limited

Date: 11" February, 2022

Place: Nagpur

M. P. Chaudhari Chairman-cum-Managing Director DIN: 05339308 MOIL Adding Strength to Steel

For All Advertisement Booking

Call: 0120-6651214

Overton and add Overton and add Company and ind For the mine. For the mine. Very and add

Xchanging Solutions Limited Registered Office: Kalyani Tech Park - Survey No 1, 6 & 24 Kundanhalli Village, K R Puram Hobli, Bengaluru – 560 066, Karnataka, India

CIN: L72200KA2002PLC030072 Tel.: +91 8043640000 Email: compliance@xchanging.com Website: www.dxc.com



Extract of Unaudited consolidated financial results for the quarter and nine months ended 31/12/2021 (Rs. in lakhs except for per share data

Particulars	31/12/2021	30/09/2021		9 1	For the nine d months ended	Year ended 31/03/2021
		/	31/12/2020	31/12/2021	31/12/2020	
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total income from operations	4,501	1 4,391	1 4,666	6 13,576	6 16,153	21,167
Net Profit for the period before tax	1,576	1,462	2 1,504	4 4,494	5,529	6,967
Net Profit for the period after tax	1,207	1,881	1,501	1 4,150	0 4,855	6,244
Total Comprehensive Income (After tax) for the period	1,256	1,749	1,590	0 4,372	2 4,617	5,959
Paid up equity share capital (Face value per share Rs 10/-, fully paid)	11,140	11,140	11,140	0 11,140	0 11,140	11,140
Other Equity (excluding Revaluation Reserve)	-	-	-	- '	-	44,429
Earnings per Equity Share (Face value of Rs.10/- each) (not annualised for the quarters)						
Basic- In Rs. Diluted- In Rs.	1.08 1.08					
Key numbers of Standalone Financial Resu	ults	· ·				

						(Rs. in lakhs)
Particulars	Quarter ended 31/12/2021	Quarter ended 30/09/2021	Corresponding quarter ended 31/12/2020		For the nine months ended 31/12/2020	Year ended 31/03/2021
	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
Total income from operations	1,409	1,300	1,154	3,890	4,238	5,548
Net Profit for the period before tax	712	609	453	1,762	1,951	2,220
Net Profit for the period after tax	481	1,129	502	1,888	1,516	1,821
Total Comprehensive Income (After tax)	483	1,128	490	1,874	1,500	1,823

Notes:

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.dxc.com/in/en/about-us/xchanging-solutions-limited-investor-relations.

> By Order of the Board of Directors Nachiket Vibhakar Sukhtankar

Managing Director and Chief Executive Officer DIN - 08778377

DIN: 00212610

Place: Mumbai



Date : February 10, 2022

Saturday 12, February 2022 F6BIS IIGIGISHS

વલસાડ, તા.૧૧: પારડીના ચંદ્રપુર હાઇવે ઉપર વલસાડ એલસીબીની ટીમે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કરતા તે અન્ય સાથે અથડાવી વાપી તરફ હંકારી લઈ જઈ બુટલેગરોએ કાર મૂકી ભાગી છૂટતા પોલીસને ૩૫૦૦૦નો દારૂ

મળી આવ્યો હતો. વલસાડ એલસીબી ટીમે ગઈકાલે રાત્રે પારડી વિસ્તારમાં પેટોલિંગમાં દરમિયાન મળેલી બાતમી આધારે પારડીના ચંદ્રપુર

છેલ્લા પાનાનુ ચાલુ... જમીન પચાવનારાને...

યોગ્ય કાર્યવાહી કરી તેમને તેમના હક્કના નાણાં અપાવવાની બાહેંધરી આપી હતી. આ મેળામાં રજૂ થયેલા પ્રશ્નોમાં જમીન સંપાદન, જમીન સુધારણા, આર.ટી.એસ., સ્ટેમ્પ ડયુટી વિભાગના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રભારી આદિજાતિ મંત્રી નરેશભાઇ પટેલ, જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટમાં જરૂરી સધારણા માટે વિધાનસભામાં બિલ લાવવામાં આવશે.

> (પેજ નં.૧નું ચાલુ...) ઉમરગામમાં લોક.....

કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, વારસામાં મળેલા જમીન નાના ટુકડામાં જેટકો દ્વારા ટાવર ઉભ્ કરવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ પરિવારના સંતાનો માટે જમીનનો નાનો ટુકડો જ આધાર છે, જો જેટકો જમીન પર ટાવર ઉભું કરે તો ગરીબ આદિવાસી ખેડૂતો ઘરવિહોણા થઈ જશે. તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શશીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું

નામ બદલેલ છે

આથી હું જણાવું છું કે , મારૂં જૂનું नाम **पटेल छनलङ्गमारी** રમણભાઈ હતું જે બદલીને મારૂ નવું નામઃ **જીનલ રમણભાઈ પટેલ** રાખેલ છે અને હવેથી હું નવા નામ તરીકે જ ઓળખાઈશ. જેની સીએ નોંધ લેવી.

લિ. જીનલ રમણભાઈ પટેલ **સરનામું :** ७७, અવધ

કિંગ્સબરી, એરૂ કેનાલ રોડ પાસે, એરૂ, નવસારી-3૯૬૪૫૦

કરતા કારચાલકે અન્ય વાહન સાથે અથડાવી કારને રોડ પર છોડી અંધારામાં ભાગી છુટ્યો હતો. પોલીસે કારની અંદર તપાસ કરતા દારૂની બાટલી નંગ ૬૪ કિંમત રૂા.૩૫,૦૦૦ કારની કિંમત રૂા.૩ લાખ, એક મોબાઇલ કિંમત

હાઇવે ઉપર વોચ ગોઠવી ઉભા દરમિયાન તે બબાતમીવાળી સફ્રેદ કલરની હ્યુન્ડાઇ કાર નંબર જીજે ૧૬ સીએચ ૪૨૮૪ આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા કાર યુ ટર્ન મારી પુર ઝડપે હંકારી જતા

તો નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ ડ્રોનથી જમીન માપણી કરાવી પ્રમોલેગેશનમાં જે એજન્સીની ભૂલ થઇ હશે તો ખેડૂતોને તેમની જમીનોનો સાચો હક્ક પાછો મળશે, તેવી આ તબક્કે ખાતરી આપી હતી. રાજયના કલ્પસર, નર્મદા અને જળસંપતિ અને પાણી પુરવઠાના મંત્રી જીતુભાઇ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો એ છેવાડાનો જિલ્લો હોવા છતાં રાજયના મહેસૂલ મંત્રીએ પસંદ કરવા બદલ ખુશી વ્યકત કરી હતી. વલસાડ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.

કે જેટકો ટાવર ઊભા ન કરતા અંડર ગ્રાઉન્ડ કેબલનો માર્ગ અપનાવે તો ખેડૂતોને મોટી રાહત મળી રહેશે.

લોક સુનાવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આવી પહોંચેલા ખેડૂતોમાં દિપકભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ જાદવ, શશીકાંતભાઈ પટેલ, માંડા ગ્રામ પંચાયત સરપંચ પરભુભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત સંદર્ભે પારડી પ્રાંત અધિકારીનો સંપર્ક કરતાં કોઈ

નામ બદલેલ છે

આથી હું જણાવું છું કે, મારૂં જૂનું નામ **રીશિ શેલેષભાઈ પટેલ** હતું જે બદલીને મારૂ નવું નામ**ઃ રીશિ શેલેષકુમાર પટેલ** રાખેલ છે અને हवेथी हुं नवा नाम तरीङे ४ ઓળખાઈંશ. જેની સોએ નોંધ

લિ. રીશિ શેલેષકુમાર પટેલ **सरनामुं :** छ२वाऽ।, ङङवाऽ। ફળિયા, હનુમાન ભાગડા, વલસાડ, તાં.જિ.વલસાડ

જાહેર નોટીસ

આથી જાહેર જનતાને જણાવવાનું કે, અમારા અસીલ રેનુ કેશરી પ્રસાદ સોની રહેવાસી- સેલવાસ, ઈન્દિરા નગર, તાર્બે- દાદરા નગર હવેલીનાઓ જેઓ સ્વ. કેશરી પ્રસાદ રામપ્રસાદ સોનીના કાયદેસરના વારસદાર તથા પત્નિ છે. સદર સ્વ. કેશરી પ્રસાદ રામપ્રસાદ સોનીનું તા.૧૩/૦૭/૨૦૨૧ ના રોજ મોજે- વી.બી.સી. હોસ્પિટલ, સેલવાસ ખાતે મરણ થયેલ છે. જેઓ કોઈપણ હક્કદાર નક્કી કર્યા વગર મરણ પામેલ છે. સદર દાદરા નગર હવેલી સંઘપ્રદેશના મોજે સેલવાસ ગામે જેઓના નામે સંપતિ આવેલ છે જેનું વર્શન નીચે મુજબ છે.

૧. ઘર મોજે- સુરજ હોટલની પાછળ, ઈન્દિરા નગર, ન્યુ મ માર્કેટ એરીયા, સેલવાસ, દા.ન.હ. ખાતે આવેલ દુ	
(પ્રોપર્ટી આઈ.ડી. નં. એસ. 01003260000 House No. / Easy City Code No. 761 NMM068-1 થી નોંધાયેલ છે.	દુકાન જેને D) SMO

સદર અમારા અસીલો સદર ઉપરોક્ત મિલકત સિલવાસા નગર પાલિકા દફતરે તેઓના તથા તેઓના સગીર પુત્રો/પુત્રી નાઓના સંયુક્ત નામે ટ્રાન્સફર કરવા માટે અરજી કરનાર છે. મજકુર ઉપર વર્ણવેલ મિલકત અંગે જો કોઈનો કંઈપણ હક્ક, હિસ્સો, વારસાઈ, ગીરો, વેચાણ, ગીફ્ટ, લીઝ, ટેન્નસ લીયન, બોજો, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ કે અન્ય દરદાવો હોય તો તેમણે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી <u>દિન-૧૫</u> માં તેવા હક્ક દાવાઓ સંબંધી દસ્તાવેજી પુરાવાઓ લાવી મુખ્ય અધિકારી સિલવાસા નગરપાલિકામાં તેમનો દાવો રજૂ કરવો યા હમો નીચે સહી કરનારને રૂબરૂ વાંધાઓ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂ કરવો નહીંતર મુદત વિત્યેથી મજકુર મિલકતમાં અન્ય કોઈના કોઈપણ હક્ક, દાવા, નથી અને જો કોઈપણ હોય તો તે જતા કર્યા છે એવું માની સદર ઉપરોક્ત મિલકતમાં અમારા અસીલો તેમના લાભમાં સદર મિલકતને સિલવાસા નગર પાલિકા દફ્તરે તેઓના સંયુક્ત નામે ઉપરોક્ત મિલકત ટ્રાંસફર કરી માલિકો તરીકે નોંધણી કરાવી લેશે અને પાછળથી મજકુર મિલકતના હક્ક થવા સંબંધી કોઈની કોઈપણ તકરાર ચાલશે નહીં જેની નોંધ લેવી.

અમારી સૂચનાથી

(રેનુ કેશરી પ્રસાદ સોની)

લિ. પંકજ એન. ભંડારી એડવોકેટ એન્ડ નોટરી **ઓફિસઃ** શોપ નં. ૦૨, કુરેશી બિલ્ડીંગ, પહેલા માળે, ટોકરખાડા, સિલવાસા, યુ.ટી. દાદરા અને નગર હવેલી અને ડીડી

શાકભાજી માર્કેટ, જ્યોતિ હોલ નીચે, વલસાડ ફોનઃ 241042 દરેક બ્રાન્ડેડ કંપનીના



વરસાદ માં ગળતા ટેરેસ તથા દિવાલમાં થી આવતા ભેજને ક્રેકફીલીંગ કરી કેમીકલ્સ વળે વોટર પ્રફીંગ કરી આપનાર

દરેક પ્રકારના મકાનો ને આકર્ષક કલર કામ કરી આપનાર



ટેરેસ ગળે છે

દમણગંગા ટાઈમ્સ

ડીસ્કલેમર/સ્પષ્ટતાઃ વાચકોને જણાવવાનું કે દમણગંગા ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેરખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી 'વિજ્ઞાપનદાતાની' જ રહેશે અને દમણગંગા ટાઈમ્સની કોઈપણ પ્રકાર્રે જવાબદારી રહેશે નહીં. વાચકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

વાપીની કિશોરી ગુમ

(દ.ગં.ટા. પ્રતિનિધિ) ૧૪ વર્ષની સ્કુલમાં ગયેલી કિશોરી પરત ઘરે નહી ફરતા પરિવારે કિશોરીનું અપહરણ થયાની ફરિયાદ કરતા પોલીસે

તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સત્રોના જણાવ્યા ભણતી ૧૪ વર્ષની કિશોરી તપાસ હાથ ધરી છે.

વાપી, તા.૧૧: વાપીની સ્કૂલમાં ગઈ હતી અને બપોરે સ્કુલમાંથી પરત ઘરે આવવા નિકળેલ કિશોરીનું રસ્તામાંથી કોઈક અજાણ્યા ઈસમે અપહરણ કરી દીધું કે પછી તે ક્યાંક ગુમ થઈ જતા વાપી ટાઉન પોલીસ મથકમાં ગુમ મુજબ વાપોના ઈમરાન થનાર કિશોરીના પરિવાર દ્વારા નગરમાં રહેતી અને નજીકની ફરિયાદ કરતા પોલીસે અંગ્રેજી માધ્યમની શાળામાં અપહરણનો ગુનો નોંધી વધુ

દહેરાદુન એક્સપ્રેસમાં પર્સ અને હેન્ડ બેગની ચોરી

વલસાડ તા. ૧૧: મુંબઈના મલાડમાં રહેતા મુસ્લિમ પરિવાર દેહરાદૂન ટ્રેનમાં રતલામ જતી વેળાએ ટ્રેનમાંથી પાકીટ ની ચોરી થતા તેમાં મૂકેલા મોબાઈલ અને રોકડ મળી કુલ ૨૫ ૯૯૦ ની ચોરી થતા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મુંબઈના વસઈ રોડ મલાડ ઈસ્ટ માં રહેતા ઇમરાન અબ્દુલ રહેમાન શાહ તેમની પત્ની સાથે તારીખ ૩ ૧૨ ૨૦૨૧ ના રોજ રતલામ જવા માટે દહેરાદુન એક્સ-ેસ ટ્રેનના કોચ નંબર એસ ૬ / સીટ નંબર ૩૩ ૩૪ પર બેસી મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના ઉં૩૦ કલાકે ઇમરાન અને તેમની પત્ની ને ઊંઘ આવી ગઈ હતી તે દરમિયાન ટ્રેનમાં ઊંઘી જતાં કોઈ ચોરી ઈસમે પર્સ અને હેન્ડ બેગ ની ચોરી કરી ગયા હતા બેગની અંદર એક મોબાઇલ કિંમત ૨૦ ૯૯૦ તથા રોકડા ૫,૦૦૦ મળી કોલ ૨૫૯૯૦ ની મતાની ચોરી થઈ ગઈ હતી જે અંગે ઇમરાન

CHANGE OF NAME

I HAVE CHANGED

MY NAME FROM

MISTRY NANDANI

NARESHBHAI TO

NANDANI NARESH

MISTRY

ADDRESS: 4/328,

MITNAWAD,

KHARIWAD, NANI

DAMAN-396210.

જ.મ.પ.અ.નં. ૩૯૯/૨૦૨૧

સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ

પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પારડીની કોર્ટમાં,

તા.પારડી, જી.વલસાડ (વ.શ્રી. ડી.જી. રાઠોડ)

જન્મ-મરણ અધિનિયમ-૧૯૭૭ની કલમ-૧૩(૩) અન્વયે મરણની નોંધ કરાવવા

<u>માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટિસ</u>

હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી ગુલાબસીંહ અભેસીંહ ઠાકોર, રહે. રાબડી, મંદિર

ફળિયા, તા.પારડી, જી.વલસાડનાઓએ તેમના પુત્ર ઠાકોર પંકજકુમાર ગુલાબસીંહનો

નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભુલ અને શરતચુકથી કરવાની રહી ગયેલ છે.

જેથી અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. સદર જન્મની નોંધણી બાબતે કોઈને વાંધો

યા તકકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી પારડી, પ્રાંત કચેરી

પારડી, જી.વલસાડની કચેરીએ વાંધા રજ કરવાના રહેશે. જો વાંધો નહીં આવે તો વાંધો

નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા

FOOTWEAR

Lakhani shoes

AC Showroom

શુટીંગ, શર્ટીંગ તથા

લેટેસ્ટ કીઝાઇનમાં

ટેલરીંગ

શુટ સિવકાવો કાપક તથા

સીલાઇ સાથે ગ્ર.5000/-

NIRVĀN

Siyarams

એમ. જી. રોઠ, વલસાઠ. ફોન : ૨૪૮૧૭૬

DONEAR

આજરોજ તા.૧૭/૦૧/૨૦૨૨ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

કોર્ટનો સિક્કો

acti n

આથી લાગતા વળગતા ઈસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ

CHANGE OF NAME

અરજદાર : ગુલાબસીંહ અભેસીંહ ઠાકોર

સામાવાળા : તલાટી કમ મંત્રીશ્રી

ઈસમોએ નોંધ લેવી.

સેલ..

સેલ. વ

સેલ.

Raymond

DIGJAM

ાં. એમએજી/જન્મ/૨જી નં.૩૯૯/૨૦૨૧

સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, પારડીની કચેરી,

પારડી, તા.પારડી, જી.વલસાડ

તાલુકા સેવા સદન, બ્લોક નં.૨, પહેલો માળ,

રહે. રાબડી, મંદિર ફળિયા,

ગ્રામ પંચાયત કચેરી રાબડી, તા. પારડી, જી.વલસાડ

I HAVE CHANGED MY NAME FROM **PAVANKUMAR JAIN** TO PAVAN JAIN ADDRESS: 10/213, MASTER SHERI, NANI DAMAN-396210.

૧૦૦૦ મળી કુલ રૂા.

૩,૩૬,૦૦૦નો મુદ્દામાલ ઝડપી

પાડ્યો હતો. જ્યાં વલસાડ

એલસીબીએ પારડી પોલીસ

મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી

અલકાબેન શાહ, વલસાડ,

ધરમપુર અને ઉમરગામના

ધારાસભ્યો સર્વ ભરતભાઇ પટેલ,

અરવિંદભાઇ પટેલ અને

રમણભાઇ પાટકર, વલસાડ

જિલ્લા વિકાસ અધિકારી મનીષ

ગરવાની. વલસાડના નિવાસી

અધિક કલેકટર એન. એ.

રાજપૂત, પ્રાંત અધિકારી

નીલેશભાઇ કુકડીયા, પારડી પ્રાંત

અધિકારી તેમજ વલસાડ, પારડી,

ધરમપુર, કપરાડા અને

ઉમરગામના મામલતદારો તેમજ

મહેસલ વિભાગના અધિકારીઓ

અને કર્મચારીઓ હાજર રહયા હતા.

પ્રશ્નોનો સમયસર નિકાલ થાય તે

માટે ગામેગામ ફરિયાદ નિવારણ

કાર્યક્રમ યોજે છે અહીં તો જેટકો

કંપનીની સમસ્યાના ઉકેલ માટે

લોક સુનાવણી રાખવામાં આવી

છે જેમાં ખેડૂતો ઉપસ્થિત થયા

પરંતુ અધ્યક્ષસ્થાને અધિકારીની

ગેરહાજરીને કારણે લોકોએ ધરમ

ધક્કો ખાવો પડયો હતો.

રાજ્ય સરકાર એક તરફ

પ્રત્યત્તર મળ્યા ન હતો.

આ કાર્યક્રમમાં વલસાડ

ગુનો નોંધાવ્યો હતો.

પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.

AEGIS

અબ્દુલ શાહે વલસાડ રેલવે

આદિજાતિ વિકાસ વિભાગ, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સીપેટ સંચાલિત, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, ખુંધ, ચીખલી ખાતે નવસારીના સાંસદ સી.આર. પાટીલ. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર રાજયમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં તા.૧૨/ ૦૨/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ કાલકે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે તેમ પ્રાયોજના વહીવટદાર, વાંસદા દ્વારા જણાવાયું છે. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના અનેક વિસ્તારના લોકો ટ્રેની થયેલા ઉપસ્થિત રહેશે.

ચીખલી ખાતે આજે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકોપંણ **AEGIS**

એજીસ લોજીસ્ટીક્સ લિમિટેડ

CIN : L63090GJ1956PLC001032 ૨જી. ઓફિસ: ૫૦૨, સ્કાયલોન, જી.આઈ.ડી.સી., ચાર રસ્તા, વાપી- ૩૯૬ ૧૯૫, જી.વલસાડ, ગુજરાત કોર્પો. ઓફિસ: ૧૨૦૨, બી.ટાવર, પેનીન્સુલા બિઝનેસ પાર્ક, જી.કે.માર્ગ,

ડિવિડન્ડ પર ટેક્સ ડિડક્શન એટ સોર્સ અંગે શેરધારકોને સામાન્ય જાણ

તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના યોજાયેલી કંપનીના બોર્ડ ઓફ્ર ડિરેક્ટરોની બેઠકમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧ . ઈક્વીટી શેર દીઠ રૂા. ૨ (બે રૂપિયા)નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરાયું હતું અને ાચગાળાનું ડિવિડન્ડ પ્રાપ્ત કરવા માટે લાયકાત ધરાવતા શેરધારકોના નામ નક્કી કરવા માટેની રેકોર્ડ ડેઈ તરીકે તા.૧૪ તરીકે તા.૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૨ નક્કી કરવામાં આવી હતી. ફાયનાન્સ એક્ટ, ૨૦૨૦ના સુધાર મુજબના ધ ઈન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ (''ધ એક્ટ'')ની જોગવાઈઓને અનુસરતા તા.૧ અપ્રિલ ૦૨૦થી શેરધારકોને મળેલ ડિવિડન્ડ વેરાપાત્ર છે. તેથી કંપની માટે ચૂકવવામાં આવનાર ડિવિડન્ડ પ એટ સોર્સ કર કપાત કરવી જરૂરી છે. કંપની દ્વારા કાપવામાં આવનાર ટીડીએસની રકમનં નિર્ધારણ શેરધાર: દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને રેસીડેન્સીયલ/લીગલ સ્ટેટ્સના પુષ્ટિ પર આધારિત હશે શેરધારકોની જુદીજુદી શ્રેણીઓ માટે ટીડીએસથી મુક્તિ માટે ભરવાના જરૂરી દસ્તાવેજો સહિતની અ અંગેની વિગતો જે તા.૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૨ના શેરધારકોને ઈ-મેઈલ કરવામાં આવી છે અને ૨ કંપનીની વેબસાઈટ h<u>ttp://www.aegisindia.com/ Dividend.aspx.</u> ખાતે પણ ઉપલબ્ધ દે શેરધારકોને દસ્તાવેજો કંપનીના રજીસ્ટ્રાર તથા ટ્રાન્સફર એજન્ટ ('RTA') એટલે કે લીંક ઈનટાઈમ ઈન્ડિય પ્રા લિ. ને https://linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html અપલો કરવા અથવા aegisd<u>ivtax@linkintime.co.in ને 'ટેક્સ</u> એક્ઝામશન રીલેટેંડ ડોક્યુમેન્ટસ' વિષ્ સાથે તા.૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં અપલોડ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. એે તારીખ પછ ટેક્સ નિર્ધારણ અંગે કોઈ સંદેશા વ્યવહારને ધ્યાને લેવામાં આવશે નહીં.

> સહી/-મોનિકા ગાંધી કંપની સેક્રેટરી

સ્થળ : મંબઈ તારીખ : ૧૧.૦૨.૨૦૨૨

AEGIS LOGISTICS LIMITED Regd.Office: 502, Skylon, G.I.D.C., Char Rasta, Vapi - 396 195, Dist. Valsad, Gujarat. Corp. Office: 1202, Tower B, Peninsula Business Park, G. K. Marg, Lower Parel (W), Mumbai - 400013. Tel.: +91 22 6666 3666 • Fax: +91 22 6666 3777 E-mail: aegis@aegisindia.com • Website: www.aegisindia.com • CIN: L63090GJ1956PLC001032

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021 QUARTER ENDED NINE MONTHS ENDED YEAR ENDED **PARTICULARS** 31.12.2021 30.09.2021 31.12.2020 31.12.2021 31.12.2020 31.03.2021 Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited 1 Total income from operations (net) Net Profit for the period/year (before Tax 13,207 12,391 10,622 34,631 24,316 33,560 Net Profit for the period/year before tax 13,207 12,391 10,622 34,631 24,316 33,560 (after Exceptional and/or Extraordinary ite Net Profit for the period/year after tax (after Exceptional and/or Extraordinary items) 10.928 10,133 7,821 28,282 17.924 24,922 Total Comprehensive Income for the period/year [Comprising Profit for the period/year (after tax) and Other Comprehensive Income (after tax)] 10,121 3,510 6 Equity Share Capital 3,510 3,454 7 Other Equity as shown in the Audited Balance Sheet 190,137 Earnings Per Share (of ₹ 1/- each) (for continuing and discontinued operations) 2.69 6.49 2.90 2.69 2.03 7.49 4.50 6.36 Diluted (in ₹) The key data relating to unaudited standalone financial results of Aegis Logistics Limited for the quarter and nine months

(₹ in Lacs except per share data QUARTER ENDED NINE MONTHS ENDED YEAR ENDED **PARTICULARS** 31.12.2021 30.09.2021 31.12.2021 31.03.2021 No Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited 1 Total Income from Operations 31,696 25,788 19,684 79,405 46.217 70,490 Net Profit/(Loss) for the period/year before tax (after Exceptional and/or Extraordinary items) 27,791 8,110 4.967 42,219 8.007 18,190 Net Profit/(Loss) for the period/year after tax 3,819 25,791 6,125 36,705 6,195 15.597 (after Exceptional and/or Extraordinary items)

4 Total Comprehensive Income for the period/ year 25,779 6,114 3.804 36,671 6,150 Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com, www.nseindia.com or www.aegisindia.com)

> For and on behalf of the Board Rai K Chandaria

ended December 31, 2021

Chairman & Managing Director

Place: Mumbai Date : February 10, 2022

CHANGE OF NAME I HAVE CHANGED

MY OLD NAME FROM AARIF CHOPDA TO NEW AME ARIF CHOPDA PLEASE NOTE SD: ARIF CHOPDA

CHANGE OF NAME

I HAVE CHANGED MY OLD NAME FROM SABEENA RAHIM KHUTLIWALA TO NEW NAME SABINA RAHIM **KHUTLIWALA** PLEASE NOTE SD: SABINA RAHIM **KHUTLIWALA**

CHANGE OF NAME

I HAVE CHANGED MY OLD NAME FROM SAYJIN ARIF CHOPRA TO NEW NAME SAYJIN ARIF CHOPDA PLEASE NOTE SD: SAYJIN ARIF **CHOPDA**

CHANGE OF NAME

I HAVE CHANGED MY OLD NAME FROM SUJAN ARIFBHAI CHOPDA TO NEW NAME SUJAN ARIF **CHOPDA PLEASE** NOTE SD: SUJAN ARIF **CHOPDA**

CHANGE OF NAME

I HAVE CHANGED MY OLD NAME FROM NILOFAR ARIF CHOPDA TO NEW NAME NILIFA ARIF CHOPDA PLEASE

NOTE SD: NILIFA ARIF CHOPDA.

Regd Office: Harsh Avenue, 302, 3rd Floor, Opp. Silvassa Police Station, Silvassa - 396230. Dadra & Nagar Haveli (U.T.)
Corporate office: B-3, MIDC, Village Mira, Mira Road (East), Thane - 401107.

Extract of the Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months Ended December 31, 2021

0-		For t	he Quarter E	nded	For Nine Mo	onths Ended	Year Ended
Sr. No.	Particulars	31.12.2021 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.12.2020 (Unaudited)	31.12.2021 (Unaudited)	31.12.2020 (Unaudited)	31.03.2021 (Audited)
1. 2.	Total Income from operations (net) Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	2,864.18 479.73	3,201.13 626.69	3,228.19 625.95	9,337.40 1,744.98	7,991.37 1,389.36	11,756.51 2,182.08
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	479.73	626.69	625.95	1,744.98	1,389.36	2,182.08
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	360.15	462.52	455.47	1,299.65	971.69	1,613.79
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	360.15	462.52	455.47	1,299.65	971.69	1,615.38
6.	Paid up Equity Share Capital (Face Value Per Share Rs. 10/-)	859.85	859.85	859.85	859.85	859.85	859.85
7.	Earnings Per Share (before and after Extraordinary items) 1. Basic: 2. Diluted:	4.19 4.19	5.38 5.38	5.30 5.30	15.11 15.11	11.30 11.30	18.79 18.79

Note: The above is an extract of the detailed format of financial results for the Quarter and Nine Months ended December 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Nine Months ended financial results are available on the Stock Exchange websites viz. www.bseindia.com. The same is also available on the Company's website viz. www.pmlindia.com.

Place : Thane Date : February 11, 2022

Sharad Taparia Managing Director



To Book an appointment call:

7567190447, 7284002401